

RP WEB SOLUTIONS
Website For Everyone...

Ronak Palan
Web Consultant

+91 84888 55506

rpwebsolutions2020@gmail.com

(ટેક્સ સંલગ્ન તથા અન્ય મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરતું માસિક)

ટેક્સ ટુડે

RNI No.GUJGUJ/2016/74805

Tax Today (Monthly)

કરવેરા સલાહકાર

સીધા અને આડકતરા કરવેરાની સાદી અને સરળ ભાષામાં માહિતી આપતું ગુજરાતી પબ્લિકેશન

વાર્ષિક લવાજમ :- ૩૩૯૫

સંપર્ક:-
પૂજા પબ્લિકેશન
મનિષ શાહ
૯૯૨૪૧ ૧૯૩૯૯

Post. Regn. No. G-JND/338/2020-2022. - Office of posting Una Post Office on 3rd Monday of Every Month

વર્ષ: ૮, અંક: ૯, સર્ગ અંક: ૯૩, તા.૨૦/૦૭/૨૦૨૪, શનિવાર, પાના-૪, છૂટક અંકની કિંમત રૂ.૨૦/- (કુચીર સાથે રૂ.૩૦૦/-)
તંત્રી-માલિક અને પ્રકાશક: ભવ્ય ટિપ્પનલ પોપટ, પ્રકાશન સ્થળ: ૨૦૨-૨૦૩, ધ્રુવ કોમ્પ્લેક્સ, પોલીસ લાઈન સામે, ઉના, જી.ગીર સોમનાથ-૩૬૨૫૬૦
ફોન : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, ફેક્સ : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, મો. : ૯૮૨૪૧ ૨૧૭૦૦ સુવર્ણ સ્થળ : પ્રથમેશ ઓફિસ, ગોદરા ચોક, ઉના

e-mail: taxtodayuna@gmail.com ◆ e-mail: editor@taxtoday.co.in ◆ www.taxtoday.co.in

પ્રતિશ્રી,

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ધ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદના સંયુક્ત ઉપક્રમે ઈન્કમેટેક્સ અને જીએસટી કાયદા અન્વયે મોડીસીયલ સેમિનાર યોજાયો

હોટલ બેલગીઓ, પીપલગ મુકામ ખાતે થયું સેમિનારનું આયોજન



તા. ૧૪.૦૭.૨૦૨૪ આ સેમિનારના મોડીસીયલ કમિટી એજીએફટીસી પ્રમુખ સીએ (ડૉ.) વિશ્વેશ શાહ, આઈપીસી સીએ સ્વી



શાહ, ટીપીએ પ્રમુખ ચેતન ગજજર, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એડવોકેટ આશુતોષ ઠક્કર, એજીએફટીસી મંત્રી મુદાંગ વકીલ, ટીપીએ મંત્રી વિનિત



સોની, વક્તાશ્રી સીએ હરિત ધારીવાલ, સીએ પુનિત પ્રજાપતિના વરદ હસ્તે ઉદ્ઘાટિત કરેલ. ઈન્કમેટેક્સ વિષય પર વક્તા શ્રી સીએ હરિત ધારીવાલ અને જીએસટી વિષય પર શ્રીસીએ પુનિત પ્રજાપતિ એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સો ઉપસ્થિત શ્રોતાઓને મંત્ર મૂઘ્ય કરી દીધેલ. આ પ્રસંગે એજીએફટીસી પાસ્ટ પ્રેસિડેન્ટ એડવોકેટ ડૉ. ધ્રુવેન શાહ, આઈટી બાર પ્રેસિડેન્ટ શ્રીધર શાહ, અનિલ પરીખ, ટિપ્પ શાહ, સહમંત્રી અમિત સોની, અમિત પંચાલ આમ બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ ટેક્સ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈને આ સેમિનારને સફળ બનાવેલ.

અમિત સોની, ટેક્સ ટુડે

ઓલ ગુજરાત ફેડરેશનની ૩૨મી વાર્ષિક સાધારણ સભાનું અમદાવાદ ખાતે આયોજન

પ્રમુખ તરીકે સી.એ. (ડૉ.) વિશ્વેશ શાહ તથા સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે આશુતોષ ઠક્કરને આપવામાં આવી જવાબદારી

તા. ૦૮.૦૭.૨૦૨૪ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન, અમદાવાદ ની ૩૨મી વાર્ષિક સાધારણ સભા હોટેલ પ્રગતિ ઈન ખાતે રાજકોટ, પ્રમુખ સીએ રવિભાઈ શાહે આયોજન આપેલ. ઉલ્લેખનીય રીતે આ વર્ષે પ્રકલ્પભર્યો શાહ પ્રમુખ પદે સીએ (ડૉ.) વિશ્વેશ શાહ, સિનિયર વીપી-આશુતોષ ઠક્કર, આઈપીસી-રવિભાઈ શાહ અને કારોબારી સભ્યોમાં આઉટ સ્ટેશન માંથી અમિત સોની, અનિલ શાહ, દીપેશ



શાહવાલા, મૌલિન શાહ, મિતીશ મોટી, રમેશ કચરણી, સંજય બુદ્ધ



અમદાવાદથી અનિલ પરીખ, ધ્રુવિન મહેતા, જીજ્ઞેશ ભગત, મોલીક પટેલ, દોશી, રાજેન્દ્ર કામ્બાર, રતિલાલ વઘાસીયા, રૂપેશ શાહ, શિવમ ભાવસાર, સુવત શાહ, રાકેશ ઠક્કર, હેતલ શાહ અને ઈન્સ્ટિટ્યૂટ મેમ્બર્સ પદે રમેશ ત્રિવેદી, સુનિલ શાહ, ભરત દવે, નીતિન વડોદરિયા, વિનિત સોનીના નામ જાહેર કરેલ તમામ નો

સર્વાનુમતે વરણી કરવામાં આવી. વર્ષ ૨૪-૨૫ માં પ્રેસિડેન્ટ ઈમરિટસ પદે સિનિયર પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી ધીરેશભાઈ શાહ ની વરણી કરવામાં આવી. ધીરેશભાઈ અને અન્ય પાસ્ટ પ્રેસિડેન્ટોએ ત્રણ વર્ષ અને નવા વરાયેલ પ્રમુખો અને ટીમને શુભેચ્છાઓ પાઠવેલ. અંતમાં સો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એજીએમને સફળ બનાવવા બદલ મંત્રી અમિત સોની એ સૌ નો આભાર વ્યક્ત કરીને સભા પૂર્ણ જાહેર કરેલ.

અમિત સોની, ટેક્સ ટુડે

ટેક્સ ટુડે ગ્રુપ ડિસ્કશનનું સાસણ દક્ષ રિસોર્ટ ખાતે આયોજન

તા. ૦૧.૦૭.૨૦૨૪ ટેક્સ ટુડે ગ્રુપ દ્વારા સાસણ દક્ષ રિસોર્ટ ખાતે ગ્રુપ ડિસ્કશનનું આયોજન તારીખ ૨૯ જૂન તથા ૩૦ જૂનના રોજ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ ડિસ્કશનમાં ગાંધી તરીકે અમદાવાદના જાણીતા CA મોનોપ હોટેલ તથા પોરબંદરના જાણીતા CA કાલેશ સોહા દ્વારા સેવા આપવામાં આવી હતી. આ ગ્રુપ ડિસ્કશનમાં ટેક્સ ટુડે ગ્રુપના જુનાગઢ, જેતપુર, વેરાવળ, ઉના, પોરબંદર, વડોદરા, રાજકોટ, અમરેલી, અમદાવાદ, વાપી, ધાનના ડેલીગેટ્સએ ભાગ લીધો હતો. CA, એડવોકેટ, ટેક્સ કન્સલ્ટન્ટ પરિવાર સહિત ગ્રુપ ડિસ્કશનના આ કાર્યક્રમમાં જોડાયા હતા. જી.એસ.ટી. અને ઈન્કમે ટેક્સના વિષયો પર સભ્યોના પ્રશ્નો ઉપર ચર્ચા કરી ગાંધી દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. સાસણ ખાતે ડુરન્ટી વાતાવરણમાં સભ્યો દ્વારા ઈન્ટિંગ્સ તથા સાઉથ આફ્રિકાના વર્ડ કપ ફાઇનલ મેચનો અનંદ પણ મોટી સ્ક્રીન ઉપર ઉદ્ઘાટવામાં આવ્યો હતો. સભ્યો વતી હરીશભાઈ સાવજિયાણી દ્વારા CA મોનોપ શહેરને તથા મહેશભાઈ ભેસાનિયા દ્વારા CA કિલ્લેશ સોહાને ટેક્સ ટુડે ગ્રુપ વતી સ્પર્ધાચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. હોટેલ દક્ષને ભાવેશભાઈ કરીયા દ્વારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું જે દક્ષ રિસોર્ટ વતી તેના માલિક કોશલભાઈ રાઈનુરા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ટેક્સ ટુડે દ્વારા આ પ્રકારના ગ્રુપ ડિસ્કશનનું નિયમિત રીતે આયોજન થતું હોય છે. સામાન્ય રીતે જેમાં સેમિનારમાં ફોઈ તજજ્ઞ વક્તા બોલે અને ડેલિગેટ્સ સાંભળે તેવી પદ્ધતિ હોય છે ત્યારે ગ્રુપ ડિસ્કશન મોડ્યુલમાં ડેલિગેટ્સ પોતાનો અભિપ્રાય આપે અને ગાંધી એ અને પોતાનો તજજ્ઞ તરીકે અભિપ્રાય આપે તેવી પદ્ધતિ દ્વારા આ ગ્રુપ ડિસ્કશનનું આયોજન થતું હોય છે.

‘ટેક્સ ટુડે’ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છા...

વિશ્વેશ શાહ પ્રમુખ
મુદાંગ વકીલ માનદંત્રી

ઓલ ગુજરાત ફેડરેશનના હોદ્દાઓ તરીકે વરણી થતાં ‘ટેક્સ ટુડે’ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન...

Best resort for Corporate events, Staff Tours etc. nr Diu

Flamingo Club & Resort

Why Flamingo is best for Corporate events??

- Nearly 40% of cost then similar hotels of Diu.
- 12% GST Credit available as situated in Gujarat.
- Facilities of Banquets and Party lawns.
- Special Suite rooms for top management.
- Best resort for family and group entertainment
- Pure Veg Restaurant
- Best in class amenities
- Water Sports facility support
- No burden of Liquor on corporates.

Amenities

- Swimming pool
- Mini Theatre*
- Gym & Indoor Sports
- Party Lawn
- Banquet
- Children Play Area

Contact: 9737021700 GM /9624121700 Front Desk
e mail: contact@flamingoclubresort.com, www.flamingoclubresort.com
Delwada Diu Road, Naliya Mandvi Ta Una. 362520

ਲੇਖ: ਸਾਇਨਸ, ਟੈਕਨੋਲੋਜੀ

સવાલ આપના જવાબ 'ટેક્સ ટુડે' એક્સપર્ટના

Dt 13.07.2024

Goods Services Tax

અમારા અસીલ ગુજરાત ખાતે જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓનો વહન થતો માલ ઉત્તર પ્રદેશમાં ડિલિવરી કરવામાં આવે છે. આ માલ માટે અધિકારી દ્વારા આદેશ વેરો, વ્યાજ, દંડ લગાડવામાં આવ્યા છે. આ આદેશ સામે અપીલ ગુજરાતમાં કરવાની રહે કે ઉત્તર પ્રદેશમાં? ઉત્તર પ્રદેશમાં વાહન ચાંદોલી ખાતે રોકવામાં આવેલ હતું. આ જગ્યાનું અપીલનું કાર્યક્ષેત્ર શું આવે તે જણાવવા વિનંતી. - જે. વી. પટેલ એન્ડ કુ. જેતપુર

જવાબ: ઉત્તર પ્રદેશ ખાતે વાહન ડિલિવરી કરી આદેશ પસાર કરવામાં આવ્યો હોય તો અપીલ ઉત્તર પ્રદેશ ખાતે જ કરવાની થાય.

નોટિફિકેશન ૧૩/૨૦૨૩ (રિફટ) તા. ૧૯.૧૦.૨૦૨૩ મુજબ "Service Provided to Government Authority by way of Water Supply નો નોટિફિકેશન ૧૨/૨૦૧૭ (રિફટ) તા. ૨૮.૦૬.૨૦૧૭ની એન્ટ્રી 3B હેઠળ માફી સેવા ગણાય છે. આ વોટર સાથેની કોઈ સર્વિસ હોય તો પણ તે માફી સર્વિસ ગણાય? જે.વી. પટેલ એન્ડ કુ. જેતપુર

જવાબ: આ સેવા ના કરારને કંપોઝીટ સપ્લાય છે કે નહીં તે બાબત પર તેની ટેક્સ જવાબદારી નક્કી કરવાની રહે. જો "નેચરલી બંડલ" સેવાનો કરાર હોય અને વાણી (વોટર)ની સપ્લાય છે મુખ્ય સપ્લાય હોય તો આ સેવાને માફી સેવા ગણી શકાય તેવો અમારો મત છે.

પડખી જીએસટી કાઉન્સિલને ભલામણ કરી તે મુજબ લાગુદાઈ વર્ષ ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ દરમિયાન કલમ ૭૩ મુજબ ટેક્સ કિમાન્ડ માર્ચ ૨૦૨૪ સુધીમાં ભરી આપે તો તેને વ્યાજ અને પેનલ્ટી માંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ જેને ઉપર જણાવેલ વર્ષ દરમિયાન કલમ ૭૩ મુજબ વ્યાજ અને પેનલ્ટી ભરીને ઓફર આપી ગયા હોય, તો જેને અગાઉ વ્યાજ અને પેનલ્ટી ભરી હોય તો તેના રિફંડ માટે શું પ્રક્રિયા કરવાની રહે તે જણાવવા વિનંતી. - અમર બારોટ, ઉના

જવાબ: જી.એસ.ટી. કાઉન્સિલની પડખી માં બિનિંગ બાબતે નોટિફિકેશન આવવાના બાદ છે. અમારા માટે આ બાબતે બજેટમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફારો સુધિત થાય ત્યારે આપના પ્રશ્નો ઉકેલ મળે તેવો



અમારો મત છે. હા, જુના અનુભવ ઉપરથી એટલું કહી શકાય કે ભરી આપવામાં વેલ રકમ રિફંડ થવાની જોગવાઈ આવે તેવી શક્યતા ખૂબ ઓછી ગણી શકાય. અમારા અસીલ માલિકી ધોરણે ઘંઘો ચલાવતા હતા. તેઓનું મુલ્ય થયું છે. તેઓના વારસદારે નોંધણી નંબર ટ્રાન્સફર તરીકે મેળવી લીધેલ છે. હવે જ્યારે જૂનો નંબર રદ કરવા અરજી કરવામાં આવે છે ત્યારે સ્ટોક ટ્રાન્સફર ઉપર શું ટેક્સની જવાબદારી આવે? શું આ માલ નવા જી.એસ.ટી. નંબર ઉપર ફરી વેચાણ કરવામાં આવે ત્યારે પણ જી.એસ.ટી.ની જવાબદારી આવે? - પરેશ જે પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, વિજાપુર

જવાબ: ના, જ્યારે મૂત માલિકના ચોપડા માંથી નવા જી.એસ.ટી. મેળવનાર તેમના વારસદારના ચોપડામાં સ્ટોક ટ્રાન્સફર થાય ત્યારે મૂત વ્યક્તિનો નંબર કેન્સલ કરાવવા સમયે કલમ ૨૮(૫) હેઠળ સ્ટોક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. હા જ્યારે વારસદાર પોતાના ધંધામાં આ સ્ટોકનું વેચાણ કરશે ત્યારે આ સ્ટોક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવશે. આ બાબત પર જી.એસ.ટી. કાયદાની કલમ ૧૮(૩)

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણપત, જેતપુર
CA કિશોર સોહા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ

ને જી.એસ.ટી. કાયદાના શિષ્યુલ ડેઈ ની એન્ટ્રી ૪ સાથે વાંચી લેવા વિનંતી.

ઈન્કમ ટેક્સ

અમારા અસીલ કોડર છે. તેઓ ઈન્કમ ટેક્સ કાયદાની 44ADA હેઠળ ૫૦%થી વધુ રકમ દર્શાવી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. શું તેઓના માટે ઈન્કમ ટેક્સ કાયદા હેઠળ ચોપડા બનાવવા

ફરજિયાત છે?

જવાબ: ના, ઈન્કમ ટેક્સ કાયદાની કલમ 44ADA હેઠળ આવક દર્શાવના કરદાતા (ડોક્ટર) માટે ઈન્કમ ટેક્સ હેઠળ ચોપડા જાળવવા ફરજિયાત નથી તેવો અમારો મત છે.

મારા અસીલ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે મારો પ્રશ્ન છે તેમાંથી મળતો પ્રોફિટ એન્ડ લોસ ઈન્કમેટેક્સ રિટર્ન ફાઈલમાં ટિમ્પેસ્ટેડેસ હેડની ઈનકમમાં કયા "બિઝનેસ કોડ"માં બતાવવાનું રહે? - વિષુષ સિંભાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ

જવાબ: ફ્યુચર એન્ડ ઓપ્શન માટે હાલ કોઈ કોડ આપવામાં આવેલ નથી. તેના માટે આપ રિટેઈલનો કોડ લઈ શકે છે.

ઈન્કમ ટેક્સ હેઠળ નવા દરો માટે માન્ય સગા પાસેથી મળેલ નિકટ કરમુક્ત ગણાય કે નહીં?

જવાબ: હા, નવા દરો હેઠળ પણ માન્ય સગાઓ પાસેથી મળેલ નિકટ કરપત્ર ના ગણાય તેવો અમારો મત છે.

Goods Services Tax

અમારા અસીલ સેકન્ડ હેન્ડ ગાડીઓનું ખરીદ વેચાણ કરે છે. જી.એસ.ટી. નું પત્રક ભરતા સમયે અમે ખરીદ વેચાણની કિંમતના તફાવત ઉપર ૧૮% જી.એસ.ટી. ભરવાની છીએ અને આ તફાવતની રકમને જ રૂબરૂ ઉપર તરીકે દર્શાવેલી છીએ. શું આ ચોચ છે? આમ કરવાથી અમારા ઈન્કમ ટેક્સના ટ્રાફીંગ ખાતામાં પણ તફાવત આવે. આ મુકેલી દૂર કરવા ઈન્કમ ટેક્સ અને જી.એસ.ટી. માં એન્ટ્રી કેવી રીતે કરવી તેનું સૂચન કરશો. - જગદીશ વ્યાસ એન્ડ એસો., એડવોકેટ

જવાબ: જી.એસ.ટી. કાયદાના નિયમ ૩૨(૫) હેઠળ વેલ્યુ એક સપ્લાય

એટલે વેચાણ અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત. માટે, આપ જે જી.એસ.ટી. પત્રકમાં કરો છો તે અમારા મતે બરાબર છે. ઈન્કમ ટેક્સ અને જી.એસ.ટી. રિટર્નમાં ફેરફાર આવે તે GSTR 9C ભરી સમજાવવો જોઈએ તેવો અમારો મત છે.

વેપારી શ્રી કરપાત્ર માલ તેમજ કરમુક્ત માલ નું વેચાણ કરે છે અને તેમનું ટર્નઓવર પ કરોડ થી વધારે છે. તેઓ ટેક્સઈન્વોઈસ બનાવે છે. તો એમને કરપાત્ર માલ તેમજ કરમુક્ત માલ બંને માટે ઈ-ઈન્વોઈસ બનાવું પડે કે માત્ર કરપાત્ર માલ માટે બનાવે તો ચાલે? અને વેપારી શ્રી કરપાત્ર માલ માટે ટેક્સ ઈન્વોઈસ બનાવે અને કરમુક્ત માલ માટે બિલ ઓફ સપ્લાઈ બનાવે તો એક જ ફર્મમાં બે પ્રકારના બિલ બનાવે તો ચાલે?

જવાબ: ટેક્સ ફી માલ માટે ઈ-ઈન્વોઈસ બનાવવું ફરજિયાત નથી. ટેક્સ ફી માલ માટે બિલ ઓફ સપ્લાઈ બનાવવાનું રહે. આમ, એક જ ફર્મમાં આ બંને ઈન્વોઈસ બનાવી શકે તેવો અમારો મત છે.

ઈન્કમ ટેક્સ

અમારા અસીલ ભાગીદારી પેટી છે. તેઓનું વેચાણ ૧,૧૨,૦૦,૦૦૦ છે. અમારો નફો થયું છે. અમારી રોકડમાં રિસીમ/પેમેન્ટ પૃથ્થક બોલી છે. આવા સંજોગોમાં ઈન્કમ ટેક્સ કાયદાની કલમ **૪૪અઈ હેઠળ ઓડિટ જરૂરી છે કે ઓડિટ વગર **ઈન્કમ-પ ભરી શકાય છે? - મંથન સરેવાળા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ૧,૧૨,૦૦,૦૦૦ જેવું ટર્નઓવર હોય પણ રેસીમ કે પેમેન્ટ બંને માંથી કોઈ પણ પૃથ્થક થી વધુ ના હોય તો ઓડિટ વગર ઈન્કમ પ ભરી શકાય છે તેવો અમારો મત છે.

- ખાસ નોંધ -

૧. જી.એસ.ટી. ની જોવાઈએની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ વિનિયોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે જાણવા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આદારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આહ્વાદ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.

૨. જી.એસ.ટી. અંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર વણા પરિભવો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડવાન્સ ફ્રેલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

૩. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભમાં આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇમેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગોમાં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સનો સીધો સંપર્ક બિનવ્યવસ્થી રીતે ના કરવો.

આ કોલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇમેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ સમય અટકાવ જરૂરી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર: આ કોલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા રાશ્ય તમામ કાળજી અભિપ્રાય કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મતનું ઉપર આધારિત છે.

બિન નોંધાયેલ વ્યક્તિને વેચાણ કરતાં વેપારીઓ ખાસ આ બાબતનું રાખે ધ્યાન!!

B2C આંતર રાજ્ય વેચાણ કરતાં વેપારીઓ માટે ક્યારે બિલમાં IGST લાગે અને ક્યારે CGST-SGST લાગે તે બાબતે આવ્યો મહત્વનો ખુલાસો



તા. ૦૨.૦૭.૨૦૨૪ રાજ્ય બહારના બિન નોંધાયેલ ગ્રાહકને વેચાણ કરતાં વેપારીઓ માટે લાગુ પડે તેવો એક મહત્વનો ખુલાસો સેન્ટરલ બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સ એન્ડ કરમ્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ ખુલાસો એ ઇન્ટીગ્રેટેડ ગુસ્ટ એન્ડ સર્વિસ ટેક્સમાં ૦૧.૦૪.૨૦૨૩ થી મહત્વનો ફેરફાર આવ્યો છે તેના અનુસંધાનમાં આપવામાં આવ્યો છે. આ ખુલાસા અનુસાર, જ્યારે કોઈ રાજ્યના વેપારી, અન્ય રાજ્યના ગ્રાહક કે અનરજિસ્ટર્ડ પર્સન (જી.એસ.ટી. નંબરના ધરાવતા વ્યક્તિ) ને માલનું વેચાણ કરે છે ત્યારે જો બિલમાં જે તે ખરીદનારનું 'એસ.એન્ડ.સપ્લાય' જે તે ખરીદનારનું રાજ્ય ગણાય. આવા કિસ્સામાં વેચનાર વેપારીને IGST લગાડવાનો રહે અને ખરીદનાર જે રાજ્યના છે તે રાજ્યને જી.એસ.ટી.ની રાજ્યના ભાગની રકમ મળે. જ્યારે બિલમાં ખરીદનારના ગામ, એડ્રેસ, રાજ્યનો ઉલ્લેખ ના કરવામાં આવ્યો હોય ત્યારે આ વેચાણ વેચનારના રાજ્યમાં પૂર્ણ થયેલ ગણાય અને આ વેચાણમાં વેચનાર વેપારીને CGST+SGST લગાડવાનો રહે અને વેચનાર જે રાજ્યના છે તે રાજ્યને GSTની રકમ મળે. આ સંકલ્પનામાં એ ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ ઉદાહરણને વધુ સરોહી રીતે સમજાવે છે એવા વ્યવહારનું જે જ્યાં ગુજરાતના Mr A દ્વારા નોંધાયેલ કંપની (એમેઝોન, ફ્લિપકાર્ટ, વી. જેવી) કે જે મહારાષ્ટ્રની માલનું વેચાણ માટે દીવ રહેતા Mr B માટે કોઈ વસ્તુનો ઓર્ડર આપવામાં આવ્યો હોય. ઉદાહરણ મુજબ જ્યારે કોઈ ગુજરાતમાં રહેતા વ્યક્તિ Mr A, ઇ કોમર્સ વેબસાઈટ જે મહારાષ્ટ્રમાં આવેલ છે તેને ઓર્ડર આપી દીવ ખાતે રહેતા વ્યક્તિ Mr B ને માલ આપવા જણાવે છે તેવા કિસ્સામાં બિલ ગુજરાતમાં રહેતા Mr A વ્યક્તિના નામે બનેલો જ્યારે "એસ એન્ડ સપ્લાય" ને માલ જ્યારે જે તે

દીવના વ્યક્તિ Mr B ને મળશે તે વ્યક્તિના રાજ્યનું ગણાશે અને IGST પૈકી રાજ્યનો ભાગ દીવ ને મળશે. આ જ બાબતને સરળ રીતે સમજાવે કે સામાન્ય વ્યવહારમાં જ્યારે ઉનાનો વેપારી M/S A જ્યારે દીવ માં રહેતા Mr B કે જેનો ગ્રાહક છે તેઓને ઉના પોતાની દુકાનથી માલ આપી રહ્યા હોય અને બિલમાં Mr B ના સરનામા તરીકે દીવનો ઉલ્લેખ કરે ત્યારે આ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર ગણાય અને વેચનાર વેપારીને IGST લગાડવાનો રહેશે. આ કિસ્સામાં "એસ એન્ડ સપ્લાય" દીવ ગણાય અને IGST પૈકી રાજ્યનો ભાગ દીવને જતો રહેશે. એવી જ રીતે, જો ઉનાના વેપારી M/S A જ્યારે દીવમાં જ રહેતા Mr B કે જેનો ગ્રાહક છે તેઓને ઉના પોતાની દુકાનથી માલ આપી રહ્યા હોય અને બિલમાં Mr B ના સરનામા બાબતે કોઈ ઉલ્લેખના હોય તેવા સંજોગોમાં આ વેચાણ ગુજરાત રાજ્ય માંનું વેચાણ ગણાય અને આ વ્યવહાર ઉપર વેચનાર વેપારીને CGST+SGST લગાડવાનો રહેશે. આવા વ્યવહારમાં "એસ એન્ડ સપ્લાય" ગુજરાત રાજ્ય ગણાય અને આ વ્યવહાર પૈકી SGSTની રકમ ગુજરાત રાજ્યને મળશે.

આ ઉપરાંત આ જોગવાઈનું ધ્યાન રાખવું કંપોઝીશન સ્કીમ હેઠળ ટેક્સ ભરતા કરદાતા માટે ખૂબ વધુ જરૂરી છે. જી.એસ.ટી. નિયમ મુજબ કંપોઝીશન સ્કીમ હેઠળના વેપારી આંતરરાજ્ય વેચાણ કરી શકે નહીં. જો કોઈ કંપોઝીશન સ્કીમમાં હોય તેવા વેપારીને આ જોગવાઈને ધ્યાને રાખવા વગર એવું બિલ બનાવવામાં આવે જ્યાં બિનનોંધાયેલ ખરીદનારનું સરનામું ખરીદનાર વ્યક્તિનું દર્શાવવામાં આવે તો આ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર ગણાય અને આંતર રાજ્ય વેચાણના કારણે વેચનાર વેપારીની કંપોઝીશન સ્કીમ હેઠળની પસંવળી રદ થઈ જતી હોય છે.

આ બાબતની ગંભીરતા અંગે વાત કરતાં જોગવાઈ જાણીતા એડવોકેટ અને ટેક્સ ટુડે એક્સપર્ટ લલિતગણપત ગણપત જણાવે છે કે "સામાન્ય રીતે આ બાબત ધ્યાને આવે ત્યારે જે તે વ્યવહાર થઈ ગયાને લાંબો સમય થઈ ગયો હોય છે. આ સામાન્ય રીતે નવા કરદાતા હોય છે તેમના ઉપર ખૂબ ખૂબ મોટી જવાબદારી ઊભી થઈ જતી હોય છે. આવા વ્યવહાર વેપારીને જ્યારેથી ક્યાં હોય ત્યારથી તેઓની કંપોઝીશનની પસંવળી રદ કરી નોંધવામાં આવતી હોય છે અને તેઓને સામાન્ય ફરોગે એટલે કે તેઓને માલ જે સેટ ઉપર કરપાત્ર હોય તે સેટ પર ટેક્સ ભરવા પાત્ર થતો હોય છે. આ સંજોગોમાં વેપારીને સામાન્ય ધરોળે ગ્રાહક પાસેથી ટેક્સની કોઈ રકમ ઉપરથી ના હોવા છતાં ટેક્સની રકમ ભરવા જવાબદાર બતા હોય છે. એટલું જ નહીં, ખરીદી ટેક્સ યુવિવી કોઈ હોવા છતાં આ ખરીદી બાબત ક્રેડિટ વેપારીને આપવામાં આવતી હોતી નથી. આમ, એક નાની ભૂલ કરદાતા માટે ખૂબ મોટી જવાબદારી થઈ ને આવી શકે છે."

IGST કાયદામાં કરવામાં આવેલ સુધારો ૦૧.૦૪.૨૦૨૩ થી લાગુ થઈ ગયો છે. આ સુધારાને અનુસર બિલ બનાવવામાં વેપારીને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ બાબત પર ધ્યાનના આપવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવાનો વારો કરદાતા માટે આવતો હોય છે. આ બાબતે કરદાતા પોતાના ટેક્સ એડવોકેટ, CA, ટેક્સ કન્સલ્ટન્ટ ને જમી ચોચ સમજ મેળવી લે તે જરૂરી છે.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

DSC SCHOOL OF COMMERCE

Veraval Road, Near Lamdhar Fatak, UNA Mo.+91 8758470700

ધોરણ ૧૦ માં ઉચ્ચ ગુણક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ૩૦% સુધીની સ્કોલરશીપ

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની ઉના પીપરવડ કો-ઓપ બેંકની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની DEO ની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની GST ઓફીસની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની INCOME TAX ઓફીસની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની માર્કેટ યુનિયન ઈન્કમી મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની ઉના કોલન પ્રા.વી.ની મુલાકાત

એડમીશન ઓપન

ધોરણ: ૧૧ અને ૧૨ કોમર્સ

ઇંગ્લીશ/ગુજરાતી મીડીયમ

<http://www.dscpublicschool.org>

શા માટે કોમર્સ DSC SCHOOL OF COMMERCE ???

- કોમર્સ શીખી કોમર્સ વિષયના તજજ્ઞો પાસેથી
- વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ માટે વિવિધ ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતો
- વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ માટે વિવિધ બેંકો તથા જી.એસ.ટી. ઈન્કમ ટેક્સ જેવી સરકારી ઓફીસની મુલાકાતો
- જી.એસ.ટી. અધિકારી, ઈન્કમ ટેક્સ અધિકારી જેવા સરકારી અધિકારીઓ, નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નિષ્ણાંત વકીલો જેવા તજજ્ઞોના લેક્ચરરોનો લાભ
- કોમર્સના વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓને લગતા વેબીનાર